

E-FILING

Date: 17th June, 2021

To,
Corporate Relationship Department,
BSE LIMITED
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001, Maharashtra

Scrip Code: 512329

Subject: Intimation regarding publication of Annual Financials Results for the Quarter and Financial Year ended on 31st March, 2021 in Newspapers

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47(3) read with Schedule III of SEBI(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“LODR”), Please find enclosed the cuttings of newspaper advertisement published on today i.e. **17th June, 2021**, of the newspapers “**Free Press Gujarat**” (English Edition) and “**LOKMITRA**”(Gujarati Edition) regarding publishing of the Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial year ended on 31st March, 2021 which were considered, approved and taken on record by the Board of Directors, in their meeting held on **15th June, 2021**.

Further, in terms of Regulation 46 of LODR, the aforesaid financial results are also uploaded on the website of the company (www.kintechrenewables.com).

Kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,
For KINTECH RENEWABLES LIMITED



Jigar Shah
Managing Director
(DIN 00385460)



Encl : as above

KINTECH RENEWABLES LIMITED

It's raining fritters



Sir — It is official: the monsoon has landed in Calcutta. This piece of news — the horrors of slush and water-logging notwithstanding — is unlikely to dampen our spirits. For it rains tebbhajas at this time of the year, with Bengalis tucking into their beloved savouries in huddles in front of street stalls. But a raging pandemic stands between the pneyaaji and the palate this year. It remains to be seen how Calcutta finds a way around this challenge.

Sir — Reading the article, "Interpreters of Maladies" (June 13), by Upala Sen was like taking a walk down memory lane. It is both exhaustive and well written and it took me a while to believe that someone has so many similar memories as me. But I would like to add some more medicines to those listed in the article. First, there was Calacreme which came in pale yellow tubs and worked wonders in lightening the scars left behind by smallpox and chickenpox. The 1974 smallpox epidemic in India gave a huge boost to the sale of this cream. Even as late as 2001, doctors have been known to prescribe the cream for the same purpose. Second would be Vinkola-12, a vitamin and iron tonic manufactured in Serampore. This tonic was believed to work wonders for the health and well-being of girls with menstrual problems, especially those suffering from excessive blood loss. Then, of course, there is Lacto Calamine, a facial lotion that Bengali mothers believed would make their daughters fair complexioned. I would also like to add that of all the cures mentioned in the article, I still use Mercurochrome and Boroline. Sir — Upala Sen's article made for delightful reading. It reminded me of a friend of mine who lives in New Jersey. Each time she comes to visit her family in Calcutta she travels back with, ironically, biryani from Arsalan for her family and friends and bottles of Aqua Ptychotis carefully wrapped in paper and old cloth. Other panaceas like Boroline, Isabgol, Milk of Magnesia and Gelsulsi are still doing brisk business in Bengal and can be found in most households. In fact, these "medicines" cut across barriers of class, caste and religion and unite a people known for their hypochondria.

Sir — The decision of the GST council to reduce tax rates of some Covid-19 related items from 12 to 5 per cent is too little and too late. The tax should have been removed from all products given the nature of these items. These can be the difference between life and death. There is already a thriving black market for these goods, a tax burden will add to people's woes.

Risks of a vaccine rollout

As the number of people vaccinated increases, a misplaced sense of security may set in

Some experts consider the vaccine rollout a reason for the surge in the number of Covid cases. It may sound curious, but they argue that the perceived sense of safety induced low adherence to the preventive measures needed to resist infection. Alarmingly, many vaccinated people — fully or otherwise — thought they could discard Covid-appropriate behaviour. Even those not yet vaccinated felt safe. In an article titled "Risk Compensation and Covid-19 Vaccines", Brit Trogen and Arthur Caplan of New York University Langone Health discuss an old concept, the Peltzman effect, to explain 'pandemic fatigue' and post-vaccination behaviour.

As Covid-19 vaccines were rolled out across the globe amid messages of optimism and euphoria, what was supposed to be a panacea actually weakened adherence to safety measures. Trogen and Caplan observed: "the effects of risk compensation such as wearing masks, washing hands, and avoiding large crowds tend to fade over time as the novelty of a threat wears off and pandemic fatigue sets in. As the number of people vaccinated increases, this effect may intensify due to a misplaced sense of security".

The Peltzman effect is named after Sam Peltzman, a professor of economics at the University of Chicago Booth School of Business, who claimed that individuals respond to safety measures with a compensatory increase in risky behaviour. Peltzman published his findings in a seminal article titled "The Effects of Automobile Safety Regulation" in the Journal of Political Economy in 1975. The idea was conceptualized in the late 1960s when the government of the United States of America made the wearing of seat belts mandatory in response to an increase in motor accidents and deaths. Peltzman observed that there was no decrease in automobile death rates in spite of such safety measures and improved car safety technologies. In fact, people drove more recklessly owing to the perceived safety of their seat belts, resulting in an increase in accidents. While the safety measures made the occupants safer it made the bystanders or pedestrians or bicyclists wearing helmets less safe, which was an unintended consequence of this regulation. The American economist, Hyman P. Minsky, developed a theory which is more or less the stock market version of the Peltzman effect. A lowering



of the perceived risk of loss raised capital asset prices and encouraged higher levels of borrowing and lending. In his 1970 article, "Financial Instability Revisited: The Economics of Disaster", Minsky argued that "stability begets instability". The level of riskiness keeps rising until things become unstable.

In his 1975 article, Peltzman argued that regulation changes behaviour that can offset the benefits of government policies. The Peltzman effect in medicine, however, is not simply an unanticipated effect of an intervention, but a specific compensatory response by patients or providers to a perceived sense of safety. A widely cited example in this context is that of risky sexual behaviour among patients receiving treatment or pre-exposure prophylaxis

for HIV. The introduction of medications that dramatically lessened the risk of HIV transmission has also been associated with decreased intention to use additional protection — the benefit is thus less than what would be expected.

What's more, "[c]onsciously or not, even those who have not received a Covid-19 vaccine may forgo masks and social distancing if they know that others are receiving the vaccine." Trogen and Caplan opined. Acknowledging and understanding the Peltzman effect is thus critical to counteracting its possible negative effects. The Peltzman effect is also an important lesson for public policymakers. Continual counselling of people, including those receiving the vaccine, is a must.

Fresh appointments at Vadodra Municipal Corporation stir up old Vishwamitri row

Ahmedabad : The issue of encroachments on Vishwamitri river in Sama area of the city has taken an interesting turn with new appointments at the Vadodra Municipal Corporation (VMC). Last week, Vadodra collector Shalini Agarwal was appointed as the VMC commissioner and she took charge on Monday. On the same day, the state Congress party appointed Ami Ravat as the leader of the opposition party in the VMC's elected wing. Ravat had been pursuing the issue of encroachments on Vishwamitri river and the issue was also raised with Agarwal. Officials of the district collectorate had then submitted a report and

according to Ravat, the report prepared during the tenure of Agarwal clearly stated that a wall near the Mangal Pandey Road in Sama was on government land. It was constructed without permission and will obstruct water if there is high flow, the report had stated.

Ravat, on Monday, wrote

to Agarwal stating that the report had also stated that it was VMC's responsibility to raze the encroachment. Now that Agarwal is at the helm of VMC and was well versed on the issue, Ravat demanded that the encroachments should be removed and legal action should be taken against those responsible.

Vadodra: Two found with throats slit in factory

Ahmedabad : In a mysterious incident, two employees of a private company in Padra were found in an injured condition from the firm's quality control department on Monday evening. The duo has been shifted to a hospital and doctors said that they are

unconscious but their condition is stable. According to the police, 28-year-old Suvarna Dorik and 22-year-old Ashwin Parmar, who work in BDR Lifesciences Private Ltd in Padra were found in an injured state inside the department by other staff on Monday evening. Their throats

Man kills daughters, hangs self to death in Gujarat

months ago. Lata died while giving birth to their third child, a baby boy.

Ghanshyam, a resident of Ekta Society, a slum area near central warehouse near Borsad crossroads in Anand city, left a note mentioning that he was not able to cope up with his wife's death.

"He has mentioned in the note that he was missing her. He was under depression. After wife's death, her parents were taking care of

their six-month-old son. He also mentioned that he is taking his two daughters along with him," said B D Jadeja, deputy superintendent of police, Anand. Neighbours in Ekta Society found the trio dead after breaking open the main door of the house on Tuesday morning. While two girls — Priyanshi, 7 and Mansi, 3 were lying on the floor, Ghanshyam's was found hanging from the ceiling.

SHIRIRAM City MONEY WHEN YOU NEED IT MOST
SHIRIRAM CITY UNION FINANCE LIMITED
 Registered Office: Office No.123, Angappa Mallean Street, Chennai-600 001.
 Branch Office: Sadguru Arcade, Nr. Tower Chowk, Above Axis Bank, Rajmahal Road, Veraval-362265. Website: www.shriramcity.in

SYMBOLIC POSSESSION NOTICE

Whereas the undersigned being the authorised officer of Shiriram City Union Finance Limited (SCUF) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(1)(f) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand notices. The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 3 of the said Rules, on this 14th day of June, 2021.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Shiriram City Union Finance Ltd. for an amount as mentioned herein below with interest thereon.

Borrower Name and Address	Demand Notice	Description of Property
1. VIJAYA SEA FOODS NAVAPARA PORT COLONY, BHIDIA PLOT NR RAMESWAR TEMPLE, VERAVAL, VERAVAL,362265	Rs. 38,85,176/- (Rupees) Thirty Eight Lakh Eighty Five Thousand One Hundred Seventy Six Only as on 20th March 2021.	In Jammarg District Taluka Lalpur, At Village:Khaton Khambhaliya Road , Originally an agriculture land bearing R.S.No 5 admeasuring 24281 sq.mtrs have converted in to Non agriculture land for industrial purpose by the order of Taluka Development Officer Lalpur and Taluka Panchayat Veraval, GUJARAT,362265
2. BARAIYA SHANTABEN DHANJIB NAVAPARA, PORT COLONY, BHIDIA PLOT, NR RAMESWAR TEMPLE, VERAVAL, VERAVAL, VERAVAL, GUJARAT,362265	Rs. 10,00,000/- (Rupees) Ten Thousand Only as on 20th March 2021.	In Jammarg District Taluka Lalpur, At Village:Khaton Khambhaliya Road , Originally an agriculture land bearing R.S.No 5 admeasuring 3013.16 Sq.Mtrs. Bounded as under. Boundary Details:- North:- 5.00 mtrs road is situated South:- Land bearing R.S.112 is situated East:- plot No.2 is Situated West:- Road is Situated
3. DHANJIB RAMJIBHAI BARAIYA NAVAPARA PORT COLONY, BHIDIA PLOT NR RAMESWAR TEMPLE, VERAVAL, VERAVAL, GU JARAT,362265	Rs. 10,00,000/- (Rupees) Ten Thousand Only as on 20th March 2021.	In Jammarg District Taluka Lalpur, At Village:Khaton Khambhaliya Road , Originally an agriculture land bearing R.S.No 5 admeasuring 3013.16 Sq.Mtrs. Bounded as under. Boundary Details:- North:- 5.00 mtrs road is situated South:- Land bearing R.S.112 is situated East:- plot No.2 is Situated West:- Road is Situated

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
 Place: Veraval, Date: 17-06-2021
 Authorised Officer
 Shiriram City Union Finance Ltd.

FORM NO. URC - 2 Advertisement giving notice about registration under Part I of Chapter XXI

(Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the Companies (Registration) Rules, 2014)

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Gujarat, Dadra and Nagar Haveli that AMELIA HEALTHCARE a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

2. The principal objects of the company are as follows:
 To manufacture, formulate, process, develop, import, export, wholesale and/or retail trade all kinds of pharmaceuticals, antibiotics, drugs, medicines, biologicals, nutraceuticals, healthcare, ayurvedic and dietary supplement products, medicinal preparations, vaccines, chemicals, chemical products, mineral waters, wines, cordials, liquors, soups, broths and other restoratives or foods and also to deal in medicinal goods such as surgical instruments, contraceptives, photographic goods, oils, perfumes, cosmetics, patent medicines, soaps, artificial limbs, hospital requisites, proprietary medicines, veterinary medicines and tinctures extracts and to carry on the business of vialling, bottling, repacking, processing of tablets, capsules, syrups, injections, ointments, etc. and also to carry on the business of chemists, druggists, buyers, sellers, agents, distributors and stockists of all kinds of pharmaceuticals and allied products.

3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at H-23, SUMEL BUSINESS PARK - 6, DUDHESWAR CROSS ROAD, SAHBAUG, AHMEDABAD-380004.

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 67, 8, Sector 3, IIT Mandi, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Date: 17-06-2021

Name(s) of Applicants
 1. ASHISH SHARMA
 2. HARDIK SHAH
 3. CHIRAG PRAJAPATI
 4. BRIJESH RAVAL
 5. SHAILESH KHADVA
 6. HITESH KANZARIYA
 7. VISHAL KHATRI
 8. SANTOSH KUMAR
 9. BALVANT PATEL

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at- Mahadev Offset, H-47 Ravi Estate, Rustom Mill Compound, Dushdevwar, Ahmedabad-4. Published from 201-2, Nandan Com. Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahd-6 Edil: Mayur Bhatt

KINTECH RENEWABLES LIMITED

Regd. Off.: Kintech House, 8, Shivalki Plaza, Opp. AMA, IIM Road, Ahmedabad - 380 015, Gujarat.

Tel. No.: (079) 26303064; E-Mail: cs@kintechrenewables.com; Website: www.kintechrenewables.com; CIN : L40105GJ1985PLC013254

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED 31ST MARCH, 2021

(Rs. in Lakhs except earning per share data)

Sr. No.	Particulars	Quarter ended 31st March, 2021		Quarter ended 31st March, 2020		Year Ended 31st March, 2021		Year Ended 31st March, 2020	
		Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited
1	Total Income from Operations	584.89	14.45	29.06	690.05	84.28			
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	17.51	8.13	24.72	41.57	64.29			
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	17.51	8.13	24.72	41.57	64.29			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	12.38	5.77	18.18	30.19	47.06			
5	Total Comprehensive Income for the period (Including Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	12.38	5.77	18.18	30.19	47.06			
6	Equity Share Capital (of Rs.10/- each)	100.00	100.00	100.00	100.00	100.00			
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year					1077.03		1046.84	
8	Earnings Per Share of Rs 10/- each (For Continuing Operations- Not Annualised) (In Rs.)								
	1. Basic	1.24	0.58	1.82	3.02	4.71			
	2. Diluted	1.24	0.58	1.82	3.02	4.71			

Notes:
 (1) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 15th June, 2021.
 (2) The figures for the quarter ended 31st March, 2021 and 31st March, 2020 are the balancing figures between the audited figures in respect of the full financial year and published year-to-date figures up to the third quarter of the respective financial year.
 (3) The above is an extract of the detailed format of Quarterly/Yearly audited Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly audited financial results is available on the website of Stock Exchange, i.e., www.bseindia.com and on the website of the Company at www.kintechrenewables.com.
 (4) We declare that Audit Report of the Company is with unmodified opinion.
 (5) Figures for the previous periods have been regrouped/rearranged, wherever considered necessary.

For and on behalf of Board of Directors of
Kintech Renewables Limited
 Jigar Shah
 Chairman & Managing Director
 (DIN: 00385460)

Place: Ahmedabad
 Date: June 15, 2021

